

સંતુલન

‘આનંદમય જન્મદિવસ’ માટે
ગુરુમાઈ ચિદ્રિલાસાનંદ દ્વારા પસંદ કરાયેલો એક સદ્ગુણ

સિદ્ધ્યોગ ધ્યાનશિક્ષક ઓલિવર હિલ દ્વારા લિખિત વ્યાખ્યા

સિદ્ધ્યોગ પથ પર, દિવ્ય સદ્ગુણ ‘સંતુલન’, અંતરની શમસ્થિતિ અથવા મનની સમતા સાથે જોડાયેલો છે. સંસ્કૃતમાં, ‘સંતુલન’ શબ્દને ‘સમત્વ’ અથવા ‘સમતા’ કહેવામાં આવે છે અર્થાત् ‘મનની સંતુલિત સ્થિતિ’. સંતુલન એ અંતર સ્થિતિને દર્શાવે છે જે સાધનાના ફળસ્વરૂપ પ્રામ થાય છે અને સાથેસાથે એ પ્રયત્નને પણ દર્શાવે છે, જે આપણે આ અંતર સ્થિતિને પ્રામ કરવા માટે કરી શકીએ છીએ.

ભારતના મહાન ગ્રંથ, શ્રીમદ્ભગવદ્ ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ પોતાના શિષ્ય, અર્જુનને કહે છે :

યોગस્થः કુરુ કર્માણિ સંભૂતિं ત્યક્તવા ધનંજય ।
સિદ્ધ્યસિદ્ધ્યોः સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે ॥ ૨.૪૮ ॥

હે અર્જુન, આસક્તિને ત્યાગીને, સફળતા અને અસફળતા પ્રત્યે તટસ્થ થઈને, યોગમાં દઢ થા, તારા બધાં કર્મ કર. કહેવાય છે કે મનનો સમત્વભાવ જ યોગ છે.¹

અહીં ભગવાન કૃષ્ણ શીખવે છે કે મનનો સમત્વભાવ જ — જેને આપણે સંતુલન પણ કહી શકીએ છીએ — યોગનો સાર છે. અને આ સ્થિતિને પ્રામ કરવા માટે તેઓ એક ઉપાય બતાવે છે : આપણે આત્મા છીએ, એ બોધને જળવી રાખીને કર્મ કરો અને એ કર્મોનાં ફળને સમર્પિત કરી દો. અર્થાત् દરેક પરિસ્થિતિમાં આપણે કોઈ સ્વાર્થ વિના, એ કરીએ જે કરવું આવશ્યક છે; આપણે એ રીતે આપણું કર્તવ્ય કરીએ જેનાથી બધાંનું કલ્યાણ થાય. એક સંતુલિત મન પ્રામ કરવા માટે આપણે ઈચ્છાઓનો ત્યાગ કરવાનો અભ્યાસ કરી શકીએ છીએ. આ અભ્યાસની અંતર્ગત એ પણ સમાવિષ્ટ હોઈ શકે છે — આપણા કર્મોનાં પરિણામને ભગવાનને કરવામાં આવેલાં અર્પણકૃપે જોવાં, અથવા આપણી પોતાની જ ઈચ્છાઓને પૂરી કરવાને બદલે પ્રત્યેક ક્ષાળની જરૂરિયાત પૂરી કરવા માટે પ્રયત્નશીલ રહેવું.

શ્રીગુરુમાઈએ તેમના પુસ્તક, *The Yoga of Discipline*, માં એક સાચા સાધકની મનોવૃત્તિનું વર્ણન કર્યું છે. ગુરુમાઈજીના શબ્દ આપણને આના વિશે વ્યવહારિક માર્ગદર્શન પ્રદાન કરે છે કે આપણે કેવી રીતે ‘યોગમાં દઢ’ થઈ શકીએ.

એક સાચો સાધક સંસારને સમતાની દાખિથી, સમતાબોધથી જુઅે છે. એક સાચો સાધક તે ‘એક’ને જ સર્વત્ર જુઅે છે; તે સંસારને ભગવાનની આંખોથી જુઅે છે. એક સાચો સાધક ‘સમતા’ એટલે કે મનની સંતુલિત સ્થિતિ જાળવી રાખે છે જેમાં તેનું કેન્દ્રણું પરમોચ્ય પર હોય છે. જે સાચો સાધક છે, તે સંસારને આ જ રીતે જુઅે છે. અને આ સમત્વબોધને પ્રામ કરવાનો એકમાત્ર ઉપાય છે, તમારા મનને વારંવાર પરમ સત્ય પર, ભગવાન પર કેન્દ્રિત કરવું.²

શ્રીગુરુમાઈ આપણને કહે છે કે આપણે આપણા મનને પરમ સત્ય પર કેન્દ્રિત કરીને સંતુલનની સ્થિતિનો વિકાસ કરી શકીએ છીએ. અને આવું કરવા માટે આપણે આપણા જીવનની નિત્ય-પરિવર્તનશીલ પરિસ્થિતિઓની પરે જોતા જોતા, આપણા મનને અપરિવર્તનશીલ આત્માના અનુભવ પર દફતાથી સ્થિર કરીએ; દરેક અનુભવના મૂળમાં વિદ્યમાન હિન્દ્ય ચેતનાને ઓળખીએ; અને આપણા બોધને વારંવાર આ પરમ સત્ય પર પાછો લાવીએ.

જ્યારે આપણે સમતા અર્થાત् મનની સંતુલિત સ્થિતિને પ્રામ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપણે દૈનિક જીવનના ઉતાર-ચઢાવને સંભાળવાના કૌશલ્યને પણ વિકસિત કરી લઈએ છીએ. જોકે ક્યારેક-ક્યારેક એવું લાગી શકે કે આપણે જીવનનાં તાણેલાં દોરડાં પર ચાલતાં-ચાલતાં ડગમગી રહ્યાં છીએ, તોપણ આપણા અંતરમાં સ્થિરતા જાળવી રાખવા માટે આપણા નિરંતર પ્રયત્નોને કારણે, આપણી અંદર વારંવાર ઊઠીને ઊભા થવાની શક્તિ હોય છે જેથી આપણે સંતુલિત રહી શકીએ.

સંતુલન માટે અભિક્ષયન

હું મનની સમત્વ સ્થિતિથી સંસારને જોઉં છું.

(અભિક્ષયન : એ કથન જેનું જાગ્રકતાથી વારંવાર ઉચ્ચારણ કરવામાં આવે છે જેથી તે આપણી ચેતનામાં ફેલાઈ જાય.)

¹ ભગવદ્ ગીતા, ૨.૪૮; સ્વામી કૃપાનંદ દ્વારા સંપાદિત, *Jnaneshwar's Gita: A Rendering of the Jnaneshwari* (અંગ્રેજી, ન્યૂઝેર્લી : સની પ્રેસ, ૧૯૮૯) પૃ. ૨૭.

² ગુરુમાઈ ચિદ્ગ્રલાસાનંદ, *The Yoga of Discipline* (સાઉથ ફોલ્સબર્ગ, ન્યૂઝેર્લી : એસ.વાય.ડી.એ. ફાઉન્ડેશન, ૧૯૯૬) પૃ. ૧૬૧.

